

શેઠ.ડી.એમ પોલીટેકનીક ઇન હોર્ટિકલ્ચર દ્વારા એન.એસ.એસ ખાસ

શિબિરનું આયોજન

શેઠ.ડી.એમ પોલીટેકનીક ઇન હોર્ટિકલ્ચર દ્વારા ગામ: વરણામાં તા: વડોદરા, જી:વડોદરા ખાતે એન.એસ.એસ અંતર્ગત તા:૨૧-૦૩-૨૦૨૨ થી ૨૭-૦૩-૨૦૨૨દરમ્યાન ખાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રોગ્રામ અધિકારી શ્રી.વી.ડી.રાઠવા, મદદનીશ સ્ટાફ અને ૪૦ સ્વયમસેવકોએ વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરેલ હતી. શિબિરનું ઉદઘાટન વરણામાં ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોક પટેલના હસ્તે કરવામાં આવેલ.પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ. પંચાલે કરેલ. એન.એસ.એસ પ્રોગ્રામ અધિકારી શ્રી.વી.ડી.રાઠવાએ કાર્યક્રમની આભારવિધિ કરેલ. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોક પટેલ અને કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ. પંચાલ તથા વરણામાં પંચાયતના સભ્યો અને ગામના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી સ્વયમ સેવકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો.

આ શિબિર દરમ્યાન સ્વયમ સેવકોએ વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિ અને જન જાગરણ કાર્યક્રમ કરેલ હતા જેવા કે ગ્રામ સફાઈ અભિયાન, વૃક્ષા રોપણ, સ્વચ્છતા રેલી, મંદિરના બગીચાની જાળવણી, વ્યસન મુક્તિ તેમજ પ્રાથમિક આરોગ્ય અંગે અવેરનેસ પ્રોગ્રામ કરેલા હતા. પ્રાથમિક આરોગ્ય જાળવણી ઉપચાર અને વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને વડોદરા જિલ્લા પંચાયત નશા-બંધી વિભાગના વિષય નિષ્ણાંતોએ માધ્યમિક શાળામાં વાર્તાલાપ આપેલ વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત ગામની હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ટોબેકો કંટ્રોલ સેલ, જિલ્લા પંચાયત દ્વારા ઈનામ આપવામાં આવેલ હતી. સ્વયમસેવકોએ ગામના બાગાયતના પ્રગતિશીલ ખેડૂત શ્રી અનુલ ભાઈ અમિનની આંબાની વાડીમાં વિવિધ જાતો ના ૧૫૦૦ જેટલા આંબા અને શ્રી ચિરાગભાઈ પટેલના હાયડ્રોપોનિક્સ યુનિટની મુલાકાત લીધેલ હતી.જેમાં લીલા પાદળા વાડા શાકભાજી , ટામેટાં, કેપ્સિકમ વગેરેની રક્ષિત ખેતીની માહિતી મેળવેલ તથા વાર્તાલાપ કરેલ.

શિબિરના સમાપન સમારંભમાં કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ. પંચાલ, ઉપ સરપંચ શ્રી વિપુલભાઈ પટેલ, ગ્રામસેવક,તલાટી કમમંત્રી અને ગામના ખેડૂતો હાજર રહ્યા હતા. સ્વયમસેવકો એ શિબિરનાં અનુભવ વિષે ચર્ચા કરી પ્રતિભાવ આપેલ હતા. અંતમાં સ્વયમસેવક શ્રી ગામિત દ્રસ્ટિનાએ સૌનો અભાર વ્યક્ત કરી શિબિરની પૂર્ણાહુતિ કરી.



ઉદઘાટન સમારંભ



પ્રાથમિક આરોગ્ય જાળવણી અંગેનો પ્રોગ્રામ




વૃક્ષા રોપણ



व्यसन मुक्ति अभियान अंगेनो प्रोग्राम



प्रगतिशील जेडूतनी आंबानी वाडीनी मुलाकात



हायड्रोपोनिक्सना युनिटनी मुलाकात



व्यसन मुक्ति रेली



स्वच्छता रेली



सझाई अभियान



ત્રિમંદિરની મુલાકાત



સમાપન સમારંભ